

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટનના ભાવિ ફેલાવાનો આકાર ઘડવામાં મદદરૂપ થાવ

બ્રેમ્પટનની નવી ઔપચારિક યોજના – “બ્રેમ્પટન પ્લાન” માટે સીટી સમુદાય પાસેથી મંતવ્યો માગી રહ્યું છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (માર્ચ 22, 2021) – સીટી ઓફ બ્રેમ્પટન આયોજન કરી રહ્યું છે, [બ્રેમ્પટન પ્લાન: સીટી સ્ટ્રક્ચર વર્કશોપ](#) આખા શહેરને આવરી લેતો, એક જાહેર વર્કશોપ શનિવાર, એપ્રિલ 10 નાં રોજ, સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી, પોતાના બ્રેમ્પટન પ્લાન પર રહેવાસીઓ, ધંધાકીય માલિકો, સામુદાયિક સમૂહો અને હિતધારકોના મંતવ્યો જાણવા માટે યોજવામાં આવશે.

સીટી ઓફ બ્રેમ્પટન સીટીની ઔપચારિક યોજનાની સમીક્ષા, બ્રેમ્પટન પ્લાનના આગામી તબક્કામાં પ્રવેશે ત્યારે આ વર્કશોપ મંતવ્યો એકઠા કરવા શ્રેણીબદ્ધ જાહેર આયોજનોનો એક ભાગ છે. બ્રેમ્પટન પ્લાન ભવિષ્યમાં સીટી કેવી રીતે ફેલાશે અને વિકાસ પામશે તે માટે એક રોડમેપ (માર્ગરેખા) બનાવશે.

વર્ષ 2021 દરમિયાન, સીટી ઓફ બ્રેમ્પટન બ્રેમ્પટન 2040 વિઝનમાંની વ્યાપક સામુદાયિક સલાહ-મસલત પ્રક્રિયાઓ રહેવાસીઓ, સામુદાયિક સમૂહો અને એજન્સીઓ, સ્વદેશી લોકો, બિલ્ડર્સ, રેવલપર્સ, સ્થાનિક હિતધારકો, અને સરકારના અન્ય સ્તરો સાથે ચાલુ રાખશે. આ મંતવ્યો બ્રેમ્પટન માટે વધારે ગતિશીલ, પર્યાવરણની દૃષ્ટિએ ટકાઉ અને વધારે આરોગ્યપ્રદ ભાવિ બનાવવામાં મદદરૂપ થશે.

સામુદાયિક પ્રતિભાવથી સીટી કાઉન્સિલને માર્ગદર્શનમાં મદદ મળશે. કાઉન્સિલ મંજૂરી આપે ત્યારે, બ્રેમ્પટન પ્લાનથી બ્રેમ્પટનનો ફેલાવો અને ભાવિ વિકાસને નિયંત્રિત કરવા અને માર્ગદર્શન આપવા કાયદાકીય માળખું સ્થપાશે. બ્રેમ્પટન પ્લાન નિર્ધારિત કરશે કે 700,000 ઉપરાંતની વસ્તીવાળા ઝડપથી વિકસતા શહેરને સહાયરૂપ થવા રોડ્સ, ટ્રાન્ઝિટ અને અન્ય અનિવાર્ય માળખાગત સગવડોની જરૂર ક્યાં છે તે ઉપરાંત, આવાસો, દુકાનો અને ધંધાઓ, પાર્ક્સ, ટ્રેઈલ્સ ક્યાં બનાવવામાં આવશે.

બ્રેમ્પટનના ગત 2006 માં છેલ્લાં ઔપચારિક પ્લાન વડે, આ સીટી કેનેડામાં નવમું સૌથી વિશાળ શહેર બન્યું છે અને વસ્તી વધારો પ્રોવિન્સની સરેરાશ કરતા ત્રણ ગણો વધારે થયો છે. પ્રોવિન્સની અને પ્રાદેશિક આયોજન નીતિઓમાં પણ ફેરફારો થયા છે. બ્રેમ્પટન પ્લાન *બ્રેમ્પટન 2040 વિઝન*ની મહત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા સીટીની વ્યૂહાત્મક યોજનાઓ, પ્રોજેક્ટ્સ, અને વિકાસની સાથે સાથે આ આયોજન નીતિઓને અનુરૂપ રહેશે: *મોઝેઈક (રચના) જીવંત રાખવી તેમજ કાઉન્સિલની અગ્રતાઓની પરિભાષાને ટેકો આપવો.*

રહેવાસીઓને હાલમાં ચાલુ પહેલો વિશે વધુ જાણવા, આગામી આયોજનો માટે નોંધણી કરાવવા અને તમારા માટે મહત્વની બાબતો પર અમારો મત જાણવા વેબસાઈટ Brampton.ca/BramptonPlan જોવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. પ્રશ્નો કે ટિપ્પણીઓ માટે ઈમેઇલ મોકલો, /sqmail/src/compose.php?send_to=opreview@brampton.ca.

અવતરણો (ક્વોટ્સ):

“સીટી ઓફ બ્રેમ્પટનમાં અમે જે કંઈ કરીએ છીએ તેમાં લોકો હાઈસમા સ્થાને છે. અમે પ્રગતિ કરવા ભાગીદારી પણ કરીએ છીએ, એટલે જ બ્રેમ્પટન પ્લાન માટે લોકોના મંતવ્યો બહુ મહત્વપૂર્ણ છે, આપણાં શહેરનો ફેલાવો અને વિકાસ થાય એટલે સીટી ઓફ બ્રેમ્પટનને ભવિષ્યમાં માર્ગદર્શન આપવા. આ સલાહ-મસલત પ્રક્રિયા દરમિયાન, અમે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય તેવું સર્વગ્રાહી શહેર બનાવવા દરેક વ્યક્તિને મંતવ્યો પૂરા પાડવા કહીએ છીએ.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રમ્પટન

“બ્રમ્પટન 2040 વિઝન: લિવિંગ ધી મોડેર્ન (રચના જીવંત રાખવી) એ બ્રમ્પટન માટે બહુ ટકાઉ અને ગતિશીલ ભાવિ દર્શાવે છે. બ્રમ્પટન પ્લાન પ્રક્રિયાનો મહત્વનો ભાગ છે અને અમે અમારી ઔપચારિક યોજનાની સમીક્ષાના આગામી તબક્કામાં પ્રવેશીએ એટલે અમે રહેવાસીઓ સાથે પ્રવૃત્તમય રહેવાનું આગળ વધારવા આશાવાદી છીએ. સાથે મળીને, આપણે એક સાબૂત અને વિચારશીલ માળખું સ્થાપીશું જે ખાતરી કરાવશે કે સીટીના લાંબા-ગાળાના દૂરંદેશીપણાને અમલમાં મૂકવા સીટીના બંધાં આયોજનો, પ્રોજેક્ટ્સ અને વિકાસ કાર્યો સાથે મળીને કાર્યરત છે.”

- માર્ટિન મેડેઇરોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; પ્રમુખ, આયોજન અને વિકાસ સમિતિ, સીટી ઓફ બ્રમ્પટન

“આયોજન અને વિકાસ સમિતિના ઉપ-પ્રમુખ તરીકે, બ્રમ્પટન એ રીતે વિકાસ પામતું હોવાની ખાતરી કરવી અમારી અગ્રતા છે કે જેનાથી સમગ્ર સમુદાયને લાભ થાય, અમારી પ્રાદેશિક ઔપચારિક યોજનાને અનુરૂપ હોય, અને બ્રમ્પટનના ભવિષ્ય માટેનો માર્ગ સ્થાપિત કરે. અમે સીટીની નવી ઔપચારિક યોજના વિકસાવીએ ત્યારે હું રહેવાસીઓ અને હિતધારકોને પોતાના વિચારો જણાવવામાં સહભાગી થઈને ક્ષણો આપવા પ્રોત્સાહિત કરું છું.”

- પેટ ફોર્ટિની (Pat Fortini), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 7 અને 8; ઉપ-પ્રમુખ, આયોજન અને વિકાસ સમિતિ, સીટી ઓફ બ્રમ્પટન

“બ્રમ્પટનની છેલ્લી ઔપચારિક યોજનાને ગત 2006 માં મંજૂરી મળી ત્યારથી, આપણાં શહેરે આપણી વસ્તીમાં 61 ટકા ઉપરાંત વધારા સાથે, નોંધપાત્ર વૃદ્ધિ અને પરિવર્તન જોયું છે. બ્રમ્પટન ગૌરવપૂર્વકનો ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય ધરાવતું એક ગતિશીલ શહેર છે. બ્રમ્પટન પ્લાન વડે સીટી ઓફ બ્રમ્પટનનું આપણે અનુભવીએ છીએ તે આવકાર્ય શહેરમાં ફેલાવાનું અને વિકસવાનું ચાલુ રહ્યું છે તે રીત અને દરેક વ્યક્તિ અનુભવવા ઈચ્છે છે તે સમુદાયના પ્રકાર પણ નિયંત્રણ આવશે.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા દુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca